

જેફરસન હેલ્થ

નાણાકીય સહાય નીતિ – સ્પષ્ટ ભાષા સારાંશ

જેફરસન હેલ્થની નાણાકીય સહાય નીતિ (“એફએપી”) એવા દર્દીઓને નાણાકીય સહાય પૂરી પાડવા માટે અસ્તિત્વ ધરાવે છે જે આરોગ્ય સંભાળની જરૂરિયાતો ધરાવતા હોય અને જેની પાસે વીમો ન હોય, અપૂરતો વીમો હોય, અન્ય સરકારી સહાય માટે અપાત્ર હોય, અથવા આકસ્મિકતામાં અથવા તેમની વ્યક્તિગત નાણાકીય પરિસ્થિતિ અનુસાર અન્ય તબીબી રીતે જરૂરી આરોગ્ય સંભાળ સેવાઓ માટે ચુકવણી કરવા અસક્ષમ હોય. નાણાકીય સહાય મેળવવા ઇચ્છુક દર્દીઓએ અહિયાં નીચે સંક્ષિપ્તમાં આપવામાં આવેલ કાર્યક્રમમાં અરજી કરવી ફરજિયાત રહેશે.

માન્ય સેવાઓ: નાણાકીય સહાય માત્ર આકસ્મિકતા માટે અને અન્ય તબીબી રીતે જરૂરી આરોગ્ય કાળજી સેવાઓ માટે જ ઉપલબ્ધ છે. જેફરસન હેલ્થ દ્વારા આપવામાં આવતી બધીજ સેવાઓ એફએપી હેઠળ આવરવામાં આવશે નહીં. અમુક ચોક્કસ સેવાઓ જે અન્ય પ્રદાતાઓ દ્વારા અલગ રીતે બિલ કરવામાં આવે છે તે સેવાઓ આવરવામાં આવશે નહીં. કૃપા કરીને સેવાઓ આ નીતિ હેઠળ આવરવામાં આવે છે કે નહીં તે હોસ્પિટલ સેવા અંતર્ગત આવતી આરોગ્ય સંભાળ સેવા પ્રદાતાઓની યાદી માટે જેફરસન હેલ્થ એફએપીના કોષ્ટકો એ-એલ જુઓ.

માન્ય દર્દીઓ: એવા દર્દીઓ જે માન્ય સેવાઓ પ્રાપ્ત કરવા માટે યોગ્યતા માપદંડમાં ખરા ઉતરે અને તમામ જરૂરી દસ્તાવેજો સહિત પૂર્ણ એફએપી અરજી (જેફરસન હેલ્થ સહાનુભૂતિ કાળજી અરજી અને/અથવા જેફરસન હેલ્થ ન્યુ જર્સી હોસ્પિટલ કાળજી ચુકવણી સહાય કાર્યક્રમ અરજી) જમા કરાવેલ હોય.

અરજી કેવી રીતે કરવી: એફએપી અને એફએપી અરજી નીચે દર્શાવ્યા પ્રમાણે મેળવી શકાય/પૂર્ણ કરી શકાય/જમા કરાવી શકાય:

નીચે દર્શાવેલા હોસ્પિટલ દર્દી નોંધણી સ્થળો પર પેપર નકલો વિના મૂલ્યે, સ્થળ પર ઉપલબ્ધ છે. નીચે સમાવિષ્ટ ટેલિફોન નંબરો પર કોલ કરવાથી અરજીઓ માટે વિનંતી કરી શકાય છે. વધુમાં, નકલોને નીચે નિર્દિષ્ટ દરેક હોસ્પિટલ સુવિધા વેબસાઇટ પરથી મેળવી શકાય છે.

નાણાકીય સલાહકારો સહાય માટે ઉપલબ્ધ છે. દર્દીઓ નીચે દર્શાવેલા ટેલિફોન નંબરો પર એપોઇન્ટમેન્ટ ગોઠવવા કોલ કરી શકે છે.

એબિંગ્ટન હોસ્પિટલ - જેફરસન હેલ્થ 1200 ઓલ્ડ યોર્ક રોડ એબિંગ્ટન, પીએ 19001 (215) 481 - 2185 www.abingtonhealth.org	એબિંગ્ટન - લેન્સડેલ હોસ્પિટલ 100 મેડીકલ કેમ્પસ ડ્રાઇવ લેન્સડેલ, પીએ 19446 (215) 361 - 4692 www.abingtonhealth.org	જેફરસન બક્સ હોસ્પિટલ 380 નોર્થ ઓક્સફર્ડ વેલી રોડ લેંગહોર્ન, પીએ 19047 (215) 949-5117 www.ariahealth.org
જેફરસન ચેરી હિલ હોસ્પિટલ 2211 ચેપલ એવેન્યુ વેસ્ટ ચેરી હિલ, એનજે 08002 (856) 922-5115 https://kennedyhealth.org	જેફરસન ફ્રેન્કફોર્ટ હોસ્પિટલ 4900 ફ્રેન્કફોર્ટ એવેન્યુ ફિલાડેલ્ફિયા, પીએ 19124 (215) 831-2036 www.ariahealth.org	જેફરસન હોસ્પિટલ ફ્રેન્ક જ્યુરોસાયન્સ 900 વોલન્ટ સ્ટ્રીટ ફિલાડેલ્ફિયા, પીએ 19107 (215) 955-3815 https://hospitals.jefferson.edu
જેફરસન મેથોડિસ્ટ હોસ્પિટલ 2301 સાઉથ બ્રોડ સ્ટ્રીટ ફિલાડેલ્ફિયા, પીએ 19148 (215) 955-3815 https://hospitals.jefferson.edu	જેફરસન સ્ટ્રાટફોર્ડ હોસ્પિટલ 18 ઈસ્ટ લોરેલ રોડ સ્ટ્રાટફોર્ડ, એનજે 08084 (856) 346-7810 https://kennedyhealth.org	જેફરસન ટોરેસડેલ હોસ્પિટલ 10800 નાઇટ્સ રોડ ફિલાડેલ્ફિયા, પીએ 19114 (215) 612-3393 www.ariahealth.org
જેફરસન વોશિંગ્ટન ટાઉનશિપ હોસ્પિટલ 435, હર્ફવિલે-કોસ કીઝ રોડ ટર્નસવિલે, એનજે 08012 (856) 582-2638 https://kennedyhealth.org	મેગી રિહેબિલિટેશન હોસ્પિટલ 1513 રેસ સ્ટ્રીટ ફિલાડેલ્ફિયા, પીએ 19102 (215) 587-3342 https://mageerehab.org/	મીમસ જેફરસન યુનિવર્સિટી હોસ્પિટલ, આઇએનસી 111 સાઉથ 11 th સ્ટ્રીટ ફિલાડેલ્ફિયા, પીએ 19107 (215) 955-3815 https://hospitals.jefferson.edu

પૂર્ણ કરવામાં આવેલી એફએપી અરજીઓ અરજી અને/અથવા કવર લેટરમાં સમાવિષ્ટ સરનામે મેઇલ કરવી પડશે.

નાણાકીય સહાય પાત્રતા: સામાન્ય રીતે, જેની પાસે વીમો ન હોય, અથવા અલ્પ વીમો હોય તેવા દર્દીઓ જેમનાં કુટુંબની કુલ આવક ફેડરલ પોવર્ટી લેવલ (કેન્ડિય ગરીબીનું સ્તર) (“એફપીએલ”) ના 200% કરતાં ઓછી હોય અથવા તેને સમકક્ષ હોય તેવા દર્દીઓ પૂર્ણ નાણાકીય સહાય મેળવવા માટે પાત્ર છે. વધુમાં, એવા દર્દીઓ જેમની પાસે વીમો ન હોય અથવા અલ્પ વીમો હોય અને જેમનાં કુટુંબની કુલ આવક ફેડરલ પોવર્ટી લેવલ (સંધિય ગરીબીનું સ્તર) (“એફપીએલ”) ના 200% કરતાં વધુ હોય પરંતુ 500% કરતાં ઓછી હોય અથવા તેને સમકક્ષ હોય તેવા દર્દીઓ આંશિક નાણાકીય સહાય મેળવવા માટે પાત્ર છે. માત્ર એફપીએલ પર આધારિત નાણાકીય સહાય સ્તરો આ પ્રમાણે છે:

- કુટુંબની કુલ આવક એફપીએલના 200% કરતાં ઓછી હોય અથવા તેને સમકક્ષ હોય – પૂર્ણ નાણાકીય સહાય; દર્દીને \$0 બિલેબલ છે.
- કુટુંબની કુલ આવક એફપીએલના 200% કરતાં વધુ હોય પરંતુ 500% કરતાં ઓછી હોય અથવા તેને સમકક્ષ હોય – આંશિક નાણાકીય સહાય; ઓછું સહાનુભૂતિ કાળજી ડિસ્કાઉટ અથવા સામાન્ય રીતે જે રકમ બિલ થાય તે (“એજીબી”).

નોંધ: એફપીએલ સિવાય બીજા માપદંડો પણ ધ્યાનમાં લેવામાં આવી શકે (જેમકે – કુલ સંપત્તિ, રહેઠાણની સ્થિતિ, વીમાની સ્થિતિ), જે અગાઉના આપવાદોમાં પરિણમી શકે છે. જેફરસન હેલ્થ નાણાકીય સલાહકારો રજૂ કરવામાં આવેલી અરજીઓની સમીક્ષા કરશે અને એફએપીનાં અનુસંધાને નાણાકીય સહાય પાત્રતા નિર્ધારિત કરશે.

કોઈ પણ વ્યક્તિ જે એફએપી હેઠળ નાણાકીય સહાય માટે યોગ્ય ઠર્યો છે તેને આકસ્મિકતામાં એજીબીથી વધારે અથવા અન્ય તબીબી રીતે જરૂરી આરોગ્ય સંભાળ સેવાઓ કરતાં વધારે ચાર્જ કરવામાં આવશે નહીં. કોઈ પણ એફએપી-લાયક વ્યક્તિને એજીબી કરતાં હંમેશા ઓછું ચાર્જ કરવામાં આવશે અથવા એફએપી હેઠળ ઉપલબ્ધ અન્ય કોઈ પણ ડિસ્કાઉટ આપવામાં આવશે.

ભાષાંતરની ઉપલબ્ધતા: એફએપી, અરજી અને પીએલએસ અંગ્રેજીમાં અને જેફરસન હેલ્થ દ્વારા સેવા પૂરી પાડવામાં આવતા સમુદાયના 5% અથવા 1000 થી ઓછા વ્યક્તિઓ જે અંગ્રેજીમાં મર્યાદિત નિપુણતા ધરાવે છે તેવી વસ્તીની પ્રાથમિક ભાષામાં ઉપલબ્ધ છે.